


Bharat Heavy Electricals Limited (A Govt. of India Undertaking)	
UNIT: BOILER AUXILIARIES PLANT, RAIPUR	
NOTICE INVITING TENDER	
Bids are invited from manufacturers for supply of the following materials:	
1. NIT_39757 – Consultancy services for design and drafting of civil, architectural and structural works of FT plant and BM plant for various thermal power projects in India. Value of Rs. 47,06,400.00 EMD Amount: Rs. 94,130/- Period of Contract: Twelve Months Bid Submission due Date/Time – 03.08.2018/1500 hrs	
2. NIT_39756 – Material Handling work at Raw Material Stores – Receipts Offers will be received upto 1400 hrs on 27.07.2018	
Contact Person for 1 - SM / Civil Projects & Services Ph: 04172-284792, Mobile: 7967093010 E-mail: mmselvam@bhel.in, mpseelvam@bhel.in Contact Person for 2 - SM/WCM Ph: 04172-284839 E-mail: asvsn@bhel.in	
Visit: www.bhel.com, http://tenders.gov.in and http://eprocure.gov.in/cppl for details	
Note: All corrigenda, addenda, amendments, time extensions, clarifications etc., to the tender will be hosted on BHEL website (www.bhel.com) only. Bidders should regularly visit website www.bhel.com to keep themselves updated.	


ALLAHABAD BANK
A tradition of trust

Bombay Market Branch, Old Bombay Market, Umarvada, Surat.
POSSESSION NOTICE RULE 8(1) (FOR IMMOVABLE - MOVABLE PROPERTY)

Whereas, The undersigned being the authorized officer of the Allahabad Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 18/04/2017 calling upon the borrower (1) M/s Sai Sarkar, (2) Mr. Vijay R Kayasth (Partner/Guarantor), (3) Mr. Ajay K Ganjawala (Partner/Guarantor), (4) Mr. Heming D Prajapati (Partner/Guarantor), (5) Mr. Sushilbhai D Doctor (Partner/Guarantor), (6) Mr. Iqbalbhai A Kashmani (Partner/Guarantor), (7) Mr. Maheshbhai M Sheth (Partner/Guarantor) and (8) Mr. Chhaganbhai Parmathbhai Khunt (Partner/Guarantor and Mortgagor) to repay the amount mentioned in the notice being Rs.59,73,247.05 (Rupees Fifty Nine Lakh Seventy Three Thousand Two Hundred Forty Seven and Five paise Only) along with interest and other charges within 60 days from the date of receipt of the said notice.

The borrower / guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 8 of the said rules, on this **11th day of July of the year 2018.**

The borrower/mortgagor/guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Allahabad Bank, Bombay Market Branch for an amount of **Rs.40,32,985.00 (Rupees Forty Lacs Thirty Two Thousand Nine Hundred Eighty Five Only) [Total amount outstanding as per 13(2) notice Rs.59,73,247.05 less Recovery made Since 18.04.2017 is Rs.26,54,000.00 plus interest Rs.7,13,737.95] and interest and other expenses thereon.**


The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY
All the piece and parcel of the immovable property 'Shree Siddhi Residency' bearing Plot No.263, City Survey Hissa Number 1699/263 admeasuring 1403.02 sq mtrs equivalent to 15097.00 sq ftg together with undivided proportionate share in road and COP admeasuring 644.60 sq mtrs of Hissa No 1 of City Survey No 1699 Tika No 37 of Rev S Nos 336+ 336 Part + 336/2 + 336/3 of Ward No 11 situated at Navsari, Sub district Navsari, Opp. Navsari Railway Station (West) Moje. Navsari, Tal. & Dist. Navsari in the name of Mr. Chhaganbhai Parbatbhai Khunt. Boundaries: North – Plot No 59, 58, South – Road, East - Road and plot No 262, West – Plot No 264.

The Bank has issued No Objection Certificate and released charge in the below mentioned flats:

C-303 (790 Sq fts), A-404 (985 Sq fts), C-405 (790 Sq fts), C-402 (985 Sq fts), B-303 (985 Sq fts), B-402 (985 Sq fts), A-203 (840 Sq fts), B-204 (985 Sq fts), C-204 (790 Sq fts), A-304 (985 Sq fts), B-203 (985 Sq fts), B-203 (985 Sq fts), A-303 (840 Sq fts), A-201 (985 Sq fts), C-107 (790 Sq fts), C-207 (790 Sq fts), C-308 (790 Sq fts), C-105 (790 Sq fts), C-408 (790 Sq fts), C-407 (790 Sq fts), C-208 (790 Sq fts), C-307 (790 Sq fts), C-302 (790 Sq fts), A-403 (840 Sq fts).

Authorised Officer,
Allahabad Bank, Surat.


APAR INDUSTRIES LIMITED
(CIN : L9110GJ1989PLC012802)
Regd. Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.
Phone : (0265) 2331935 Fax : (0265) 2333009 Website : www.apar.com

NOTICE OF THE 29TH ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE INFORMATION

1. Notice is hereby given that the 29th Annual General Meeting (AGM) of the Shareholders of Apar Industries Limited will be held on **Thursday, 9th August, 2018** at 2.15 p.m. at the Auditorium of the Vanijiya Bhavan, Central Gujarat Chamber of Commerce, Race Course Circle, Vadodara – 390 007 (Gujarat). Notice of the meeting dated 30th May, 2018 setting out the businesses to be transacted thereat together with the Balance Sheet as at 31st March, 2018 and Statement of Profit and Loss for the year ended on that date both on Standalone and Consolidated basis, along with Notes to the Accounts, Cash Flow Statement, Directors' Report and Auditors' Report thereon and other relevant details have been sent to all the shareholders of the Company at their registered addresses and e-mailed to those shareholders whose e-mail addresses were registered with the Company.

Please note that the Annual Report 2017-18 is also available on the Company's website at www.apar.com. Physical copies of the Annual Report shall be sent on request and also available for inspection at the Registered Office of the Company during 11.00 A.M. to 4.00 P.M. except Sundays and Holidays.

2. Notice is also hereby given that pursuant to the provisions of Section 91 (1) of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from **Friday, 3rd August, 2018 to Thursday, 9th August, 2018, (both days inclusive)** to determine the names of the shareholders who shall be entitled to receive the dividend on Equity Shares for the Financial Year 2017-2018.


In terms of Section 108 of the Companies Act, 2013 read with amended Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the following information is available to the Shareholders of the Company :

Members holding equity shares either in physical form or dematerialized form, as on the cut-off-date of 2nd August, 2018, may cast their vote electronically on the business as set forth in the Notice of the AGM through electronic voting system of Central Depository Services (India) Limited (an Agency appointed for the purpose of providing e-voting facilities to the Shareholders of the Company) from a place other than venue of the AGM (remote e-voting). All the members are hereby informed that –

- The business as set forth in the Notice of the AGM dated 30th May, 2018 shall be transacted through voting by electronic means;
- The remote e-voting shall commence on Sunday, 5th August, 2018 (10.00 Hrs. IST);
- The remote e-voting shall close on Wednesday, 8th August, 2018 (17.00 Hrs. IST);
- The cut-off-date for determining the eligibility to vote by electronic means or at AGM is Thursday, 2nd August, 2018.
- Any person, who acquires shares of the Company and becomes a member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off-date i.e. Thursday, 2nd August, 2018, may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com. However, if a person is already registered with CDSL for e-voting, then existing user ID and password can be used for casting vote;
- Members may note that:
 - The remote e-voting module shall be disabled by CDSL beyond 17.00 Hrs. IST on Wednesday, 8th August, 2018 and once the vote on a resolution is cast and confirmed by the member, the member shall not be allowed to change it subsequently;
 - The facility for voting through ballot paper shall also be made available at the AGM. Ballot Paper for voting is also sent along with the Annual Report of the Company;
 - The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again;
 - A person whose name is recorded in the Register of Members or in the Register of beneficial owners maintained by the depositories as on the cut-off-date i.e. Thursday, 2nd August, 2018 shall be entitled to avail facility of remote e-voting as well as voting at the AGM through ballot paper;
- The Notice of AGM and complete Annual Report 2017-18 is available on the Company's website at www.apar.com and also on the CDSL's website at <https://www.evotingindia.com>
- In case of any query, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting user manual available at <https://www.evotingindia.com>, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or call on toll free no. 1800-200-5533.

By Order of the Board
For Apar Industries Limited
Sanjaya Kunder
Company Secretary

Place : Mumbai
Date : July 13, 2018


UltraTech Cement Limited

Regd. Office: 'B' Wing, Ahura Centre, 2nd Floor, Mahakali Caves Road, Andheri (East), Mumbai 400 093
Tel No. – 022-66917800/29267800, Fax No. – 022-66928109, Website: www.ultratechcement.com, CIN: L26940MH2000PLC128420

NOTICE TO THE EQUITY SHAREHOLDERS OF THE COMPANY
Sub: Compulsory transfer of Equity Shares to Investor Education and Protection Fund (IEPF) Suspend Account

This Notice is given pursuant to the provisions of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the IEPF Rules") notified by the Ministry of Corporate Affairs as amended from time to time.

The IEPF Rules, amongst other, contain provisions for transfer of all shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more to the Investor Education and Protection Fund Suspend Account ("IEPF Suspend Account").

The Company has sent individual communication to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF Suspend Account for the year 2010 – 11 during financial year 2018-19 at their address registered with the Company, inter alia, providing the details of these shares being transferred to IEPF Suspend Account. The list of shareholders to whom the intimation has been sent is uploaded on the website of the Company at www.ultratechcement.com. Shareholders can verify the details of unencashed dividends and the shares liable to be transferred by visiting the Company's website.

To enable us credit the dividend amount directly into your bank account, we request you to furnish us a copy of a cancelled cheque of the account into which the dividend amount should be credited, along with a request letter. In case the cancelled cheque does not bear your name, please attach a copy of your bank pass-book statement, duly self-attested.


The concerned shareholders' may note that even upon transfer of shares to the IEPF Suspend Account, they can claim the said shares along with dividend(s) from IEPF, for which detailed procedure and requirements are available at www.iepf.gov.in.

For any further information in this regard, concerned shareholders' may contact any of the following addresses:-

UltraTech Cement Limited B Wing, Ahura Centre, 2 nd Floor Mahakali Caves Road, Andheri (East), Mumbai 400 093 Tel.: +91 22 66917800 Fax: +91 22 66928109 Email: sharesutcl@adityabirla.com Website: www.ultratechcement.com	Karvy Computershare Pvt. Ltd. Karvy Selenium Tower B, PLot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad- 500 032 Tel.: +91 40 6716 2222 Fax No.: +91 40 2342 0814 Email: ultratech.ris@karvy.com Website: www.karvy.com
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------	-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

For UltraTech Cement Limited
S. K. Chatterjee
Company Secretary

Place: Mumbai
Date : 13th July, 2018


TVS MOTOR COMPANY LIMITED

Registered Office : 'Jayalakshmi Estates', No.29, Haddows Road, Chennai 600 006.
Website: www.tvsmotor.com **Telephone No.** (044) 28272233 **Fax No.** (044) 28257121 **Email:** contactus@tvsmotor.com
CIN: L35921TN1992PLC022845

NOTICE OF THE 26TH ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 26th Annual General Meeting (AGM) of the members of the Company will be held on **Tuesday, 7th August 2018, at 10.35 a.m. at 'The Music Academy', New No. 168 (Old No. 306) T.T.K. Road, Royapettah, Chennai - 600 014** to transact the business as set out in the Notice of AGM dated 16th May 2018.

The Notice of AGM, Annual Report along with Attendance Slip and Proxy Form have been sent in electronic mode to members, whose e-mail IDs are registered with the Company or the Depository Participant(s) unless the members have registered their request for a hard copy of the same. Physical copies of the same have been sent to all other members at their registered address in the permitted mode. The Company has completed dispatch of Notice and Annual Report on 13th July 2018.

The copy of the Notice of AGM and the Annual Report are also available on the Company's website www.tvsmotor.com and also on the National Securities Depository Limited (NSDL) website www.evoting.nsdl.com. Members, who had not received the Annual Report may download it from the Company's website or may request for a copy of the same by writing to the Company Secretary at the above mentioned email ID or at the Registered Office address of the Company. Members holding shares either in physical form or dematerialized form as on the cut-off date (31st July, 2018) may cast their vote electronically on each item of the business as set forth in the Notice of the 26th AGM through the electronic voting system on NSDL from a place other than the place of venue of AGM ('remote e-voting').

All the members are informed that:

- The ordinary and special business as set out in the Notice of AGM may be transacted through voting by electronic means.
- The remote e-Voting shall commence at 9.00 a.m. (IST) on Saturday, 4th August, 2018.
- The remote e-Voting shall end at 5.00 p.m. (IST) on Monday, 6th August 2018.
- Remote e-Voting shall not be allowed beyond 5.00 p.m. (IST) on Monday, 6th August 2018.
- The remote e-Voting module shall be disabled for voting after the date and time mentioned above. Once the vote on a resolution is casting by a member, the member shall not be allowed to change it subsequently.
- The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is 31st July, 2018.
- Any person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on cut-off date may obtain the login ID and password by sending a request to evoting@nsdl.co.in or to Mr K Raman, Assistant General Manager - Shares, Sundaram-Clayton Limited, 1 Floor, Jayalakshmi Estates, No.29, Haddows Road, Chennai - 600 006, email: raman@sccl.co.in. However, if the member is already registered with NSDL for e-Voting then such member can use his / her existing User ID and password for casting his / her vote.
- The facility for voting through Ballot Paper shall also be made available at the venue of the AGM and the members attending the meeting who have not cast their vote by remote e-Voting shall also be able to exercise their right at the meeting through Ballot Paper.
- The members who have cast their vote by remote e-Voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again.
- A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on cut-off date only, shall be entitled to avail the facility of remote e-Voting or voting through Ballot Papers at the AGM.
- The Company has appointed Mr K Sriram, Practising Company Secretary as the scrutinizer to scrutinize both the remote e-Voting process and voting through ballot paper at the venue of AGM in a fair and transparent manner.
- In case of any queries, the member may refer to the Frequently Asked Questions (FAQs) for Members and remote e-voting user manual for Members available at the downloads section of www.evoting.nsdl.com or call on toll free no: 1800-222-990. You may also send queries / grievances relating to remote e-voting to Mr Nitin Ambure, Vice President, NSDL, Trade World - A Wing, Kamala Mills Compound Lower Parel, Mumbai - 400 013, email: nitina@nsdl.co.in, Tel.: (022) 2499 4587 or Mr K Raman, Assistant General Manager - Shares, Sundaram-Clayton Limited, email: raman@sccl.co.in.
- Please keep your most updated email ID registered with the Company / your Depository Participant to receive timely communication.

Chennai
13th July 2018

By order of the board
K Srinivasan
Company Secretary

Revised date for submission of EOI to submit Resolution Plan for SBQ Steels Limited

SBQ Steels Limited, a public limited company having its registered office at 6/13 North Avenue, Kesavaperumalpuram, Chennai-600028, Tamil Nadu, India ("Corporate Debtor") had issued an invitation for submission of expression of interest ("EOI") under the Insolvency and Bankruptcy Code, 2016 on April 20, 2018. On June 1, 2018, the eligibility criteria was revised and the date for submission of EOI was extended. Copies of EOI can be obtained from <http://www.sbgsteels.com/Media.html>.

As per the decision of the committee of creditors, it is notified that the last date for submission of EOI is now **July 20, 2018 till 6:00 p.m.**

You are requested to submit the EOI along with relevant documents to satisfy the eligibility criteria as set out in EOI published on June 1, 2018 read along with EOI published on April 20, 2018 in Business Standard, Eenaadu-Hyderabad and Dina Thanthi- Chennai, either via e-mail to ashishrathi@bdo.in or through speed or registered post or hand delivery addressed to: Mr. Ashish Rathi (Resolution Professional- SBQ Steels Ltd), BDO Restructuring Advisory LLP, The Ruby, Level 9, North West Wing, Senapati Bapat Marg, Dadar West, Mumbai 400028

All other terms and conditions remain unchanged. For details please refer to <http://www.sbgsteels.com/Media.html>.

For clarifications, if any, please contact: ashishrathi@bdo.in

Resolution Professional reserves the right to cancel or modify the process and / or not to accept and/ or disqualify any interested party / potential investor without assigning any reason and without any liability. This is not an offer document. Applicants should regularly visit the website(s) referred to above to keep themselves updated regarding clarifications, amendments, or-extensions of time, if any.

Sd/-
Ashish Rathi
(Resolution Professional – SBQ Steels Limited)

Reg. No.: IBB/I/PA-001/IP-P00568/2017-18/11010
BDO India LLP, The Ruby-Level 9, NW Wing Senapati Bapat Marg, Dadar-West, Mumbai, Maharashtra, 400028


Transpek Industry Limited

CIN: L23205GJ1965PLC001343
Regd. Office: 6th Floor, Marble Arch, Race Course, Vadodara – 390007
Website: www.transpek.com; Email id: secretarial@transpek.com
Tel: 0265-2335444; Fax: 0265-2335758

NOTICE

Members are hereby informed that the Company has completed dispatch of the Annual Report 2017-2018 and the Notice of the 52nd Annual General Meeting of the Company to be held on **Tuesday, the 07th August, 2018** at Hotel Grand Mercure – Surya Palace, Opp: Parsi Agiyari, Sayajigunj, Vadodara – 390020 at 04.00 p.m., by e-mail / physical mode by 13th July, 2018.

As required under Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, the Company is pleased to provide to its shareholders the facility to cast their vote by electronic means on all the resolutions set forth in the notice. The requisite details pursuant to the provisions of the Companies Act, 2013 and the Rules are given hereunder:

- Date and time of commencement of remote e-voting: **04th August, 2018 at 10:00 a.m.**
- Date and time of end of remote e-voting: **06th August, 2018 at 05:00 p.m.**
- Cut-off date: **31st July, 2018**
- Investors who become members of the Company subsequent to the dispatch of the Notice / E-mail and holds the share as on the cut-off date i.e. **31st July, 2018**, are requested to send written / email communication to Company's Registrar and Share Transfer Agent at vadodara@linkintime.co.in by mentioning their Folio No. / DP ID and Client ID to obtain Login-ID and Password for e-voting.
- Remote e-voting shall not be allowed beyond 05:00 p.m. on 06th August, 2018.
- A member may participate in the meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting.
- Voting by members who have not exercised his right to vote through remote e-voting and present at the meeting, will be entitled to vote through Ballot Paper / Polling Paper.
- A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only, shall be entitled to avail the facility of remote e-voting / voting on poll at in the meeting.
- The notice of the 52nd Annual General Meeting is available on the Company's website at www.transpek.com and on the website of CDSL at www.evotingindia.com.
- For electronic voting instructions, Shareholders are requested to follow the instructions given in the Notice of the 52nd Annual General Meeting and in case of any queries / grievances connected with electronic voting, shareholders may refer Frequently Asked Questions ("FAQ's") and e-voting user manual for the shareholders available at www.evotingindia.com under 'Help' section or write an email to helpdesk.evoting@cdslindia.com, address: 25th Floor, A, Wing, Marathon Futurex, Mafatal Mills Compound, N.M.Joshi Marg, Lower Parel (East), Mumbai – 400 013.

By order of the Board
For Transpek Industry Limited
Alak D. Vyas
Company Secretary & Compliance Officer

Place: Vadodara
Date: 13th July, 2018


DENA BANK
(A Government of India Enterprise)
Trusted Family Bank

Zonal Office : Giriraj Chambers, 1st Floor, Rajputpara Main Road, Rajkot - 360001. Ph. No. : 0281 - 2223077 / 2226980, Fax : 2223171
E-mail : zo.rajkot@denabank.co.in

POSSESSION NOTICE

Whereas the undersigned being the authorized officer of the DENA BANK under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued demand notice calling upon the borrowers/ mortgagors / guarantors mentioned below to repay the amount as mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

The borrowers/ mortgagors / guarantors having failed to repay the amount, notice is hereby given to the borrowers/ mortgagors / guarantors mentioned below and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her Sub Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules 2002

The borrowers/ mortgagors / guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the properties detailed below and any dealing with the said properties shall be subject to the charge of Dena Bank for the amount mentioned against the borrowers/constituents.

The Borrower's attention is invited to provision of Sub Section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the secured assets.

Description of the immovable properties and details of borrowers/constituents, dues etc.

1. Name & Address Of Borrowers	M/s. BSS Worldwide Private Ltd. : B-4 Yoganand Apartment, 41 - New Jaghnath Plot, Opp. Race Course, Rajkot, Dist. Rajkot - 360001.
Name & address of Mortgagor/guarantor	1. Shri Pranavbhai Sureshbhai Mehta (Director - Guarantor) : B-4 Yoganand Apartment, 41 - New Jaghnath Plot, Opp. Race Course, Rajkot, Dist. Rajkot - 360001. 2. Shri Hareeshbhai Chhaganlal Bhadresha (Director - Guarantor) : 240/41, Vrundavan Society, Near Nyari Filter Plant, Kalawad Road, Rajkot - 360 005. 3. Mrs. Nitaben Sureshbhai Mehta (Guarantor) : B-4 Yoganand Apartment, 41 - New Jaghnath Plot, Opp. Race Course, Rajkot, Dist. Rajkot - 360001. 4. Mrs. Rajeshreebhai Hareeshbhai Bhadresha (Guarantor) : 240/41, Vrundavan Society, Near Nyari Filter Plant, Kalawad Road, Rajkot - 360 005.
Name of Lending Branch & Date Of Demand Notice	Jagnath Plot Branch, Rajkot & Dt. 21.04.2018
Amount due to the Bank as per notice	Rs. 3,68,58,408.05 (Rupees Three Crore Sixty Eight Lakh Fifty Eight Thousand Four Hundred Eight & Paise Five Only) along with further interest
Details Of Property Of Which Possession Taken By The Bank	(1) Flat No. B-4, with measurement of 98.673 Sq. Mtrs. on the First Floor of the building known as "Yoganand Apartment" constructed over the land of City Survey No. 1065 of Ward No. 15 of Rajkot in the area known as New Jaghnath Plot Street No. 41, Rajkot. in the name of Smt. Neetaben S. Mehta and Shri Pranav S. Mehta. (2) Land admeasuring 70.60 Sq. Mtrs. With construction thereon known as Block No. 19 of Plot No.19 of T.P Scheme No. 26(D) of F.P.No. 85/1-2 paiki of Revenue Survey No. 412 paiki of Village : Mavdi in the area known as "Aaryashree" Nanamava Road, Mavdi, Rajkot in the name of Mrs. Rajeshree H. Bhadresha. (3) Unit No. B-1004 with super built up area admeasuring 116.87 Sq. Mts. On the 10th Floor of Block No. "B" along with Undivided share of land admeasuring about 32.18 Sq. Mtrs. in the scheme known as "Mondel Square" constructed over the land admeasuring 6589 Sq. Mtrs. of F.P. No. 1/1 of T. P. Scheme No. 23 of Revenue Survey No. 833 paiki, 881paiki and 834 of Village : Vejalpur, Taluka & Dist. Ahmedabad in the name of Shri Pranav S. Mehta. (4) Land admeasuring 844-48 Sq. Mtrs. each of Plot No. 144, 145 and 313 in the Sector -01, in scheme known as "Pushparaj Village" of Revenue Survey No. 416, 417/1,417/2, 419/2, 420, 421/1, 405/2, 407/part, 322/1, 31/3, 314/4, 323/3, 324/2/1 part2, 333/2, 336, 345/1, 403 part, 357 part 2, of Village : Kundal, Taluka : Sanand, Dist. Ahmedabad in the name of Shri Hareeshbhai C. Bhadresha. (5) Land admeasuring 844-48 Sq. Mtrs. of each Plot No. 146 and 147 in the Sector -01, in scheme known as "Pushparaj Village" of Revenue Survey No. 416, 417/1,417/2, 419/2, 420, 421/1, 405/2, 407/part, 322/1,31/3, 314/4, 323/3, 324/2/1 part2, 333/2, 336, 345/1, 403 part, 357 part 2, of Village : Kundal, Taluka : Sanand, Dist. Ahmedabad in the name of Mrs. Rajeshreebhai H. Bhadresha.
Date of possession of securities / immovable property	09.07.2018 and 10.07.2018
2. Name & Address Of Borrowers	M/s. White Gold Cotton Industries : Nagadaka Road, B/h ITI, National Highway, Gondal - 360311.
Name & Address Of Mortgagor- Guarantor	1. Shri Hiteshbhai B. Gajera (Partner-Guarantor) : Vardhman Nagar, Opp. Shree Ram Hospital, Gondal - 7. 2. Shri Babubhai Ravijibhai Gajera (Partner-Guarantor) : Vardhman Nagar, Opp. Shree Ram Hospital, Gondal - 7.
Name of Lending Branch & Date Of Demand Notice	Jagnath Plot Branch, Rajkot & Dt. 19.04.2018
Amount due to the Bank as per notice	Rs. 14,08,85,241.17 (Rupees Fourteen Crores Eight Lakh Eighty Five Thousand Two Hundred Forty One and Paise Seventeen Only) along with further interest
Details Of Property Of Which Possession Taken By The Bank	(1) Factory Land & Building constructed on land R. S. No. 681/paiki -2/paiki -3, Nagadaka Road, Gondal, Dist. Rajkot, admeasuring 17199.00 sq. Mtrs. And construction there on in the name of Shri Hiteshbhai Baubhubhai Gajera, (2) Residential Building constructed on land admeasuring 260.20 Sq. Mtrs. of Sub Plot No. 41+42+43/D of Gondal R. S. No. 602 paiki area popularly known as Shri Vardhman Nagar Co-Operative Housing Society Ltd. It is Part and parcel of City Survey Ward No.1, City Survey No. 211 Paiki, in the name of Shri Babubhai Ravijibhai Gajera.
Date of possession of securities / immovable property	11-07-2018
Date : 14.07.2018	
Place : RAJKOT	Authorized Officer DENA BANK

